



વાલોયોગો,

ટયુશન અંગે થોડું મનોમંથન

કોઈપણ જરૂરીઆત જ્યારે વ્યાપારી સ્વરૂપ ધારણું કરે ત્યારે હૃષણું બની જય છે બાળમંહિર કે પ્રાથમિક વર્ગોમાં ટયુશનની કોઈ જરૂરીઆત હોઈ શકે નહીં એમ અમે ચોક્કસપણે માનીએ છીએ અને 'સામાજિક મોલા' તરીકે ટયુશન કોઈ રીતં આવકારહાયક નથી જે મહવા કોઈ સામાજિક મોલાનું સ્થાન ન લઈ શકે તેવું જ ટયુશનનું. બાળકના નાનપણના સ્વાભાવિક રમતંગુમતના સમયને ટયુશનનો ભાર આપીને, આપણે જૂટવી લેવાનો અપરાધ કરીએ છીએ. અમાધારણ કિસ્સાએમાં જરૂર પડે તે: તે જરૂરીઆત અંગે શાળા વાલીને તે માટે જણાવે પરતુ બને છે એવું કે વાલી સામેથી જ ટયુશન માટે જરૂર હોય કે ન હોય તો પણ ટયુશનની માંગણી કરતા હોય છે. એ ભારે વર્ચિન લાગે છે ટકાવારીની માયા જળને વાલીએ સાચા સંદર્ભમાં સમજવા પ્રયત્ન કરવો જેઠાએ (પ્રાથમિક વર્ગોમાં ગણિતમાં સાધારણું ગુણું પ્રાપ્ત કરનાર કેટલાય વિદ્યાર્થીએ એ ટયુશનના સહારા વિના મેડિકલ એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવા હોય તેવા કિસ્સા મારી જણુમાં છે.)

શાળા કક્ષાએ એ જાહેર પરીક્ષાના કારણે ટયુશનની અનિવાર્યતા વાલીએ ને જણાતી હોય તેવું લાગે છે. મેડીકલ અને એન્જિનિયરિંગના પ્રવેશમાં ટયુશન મહત્વનો ભાગ ભજવી શકે તેમ નથી. જવાભારીની તપાસણી વ્યવસ્થા એટલી જડબેસલાક છે કે તેમાં જાઝી ગરખડ થઈ શકે તેવું જ નથી. છેલ્લા વર્ષોમાં જે ગરખડ થઈ છે. તે પરીક્ષા કેન્દ્રોપર અને પછી ઘણા ઉપરના સ્તરે જ તે થઈ છે, અને સમાજમાં મુલ્યોનું પતન થયું છે તેનું એ સીધું પરિણામ છે.

આ સંસ્થામાં શિક્ષકોને ટયુશનના કાર્યાલારણમાં ઉમેરો કરી શકાય તેમ નથી આથી વાલીએની માંગણી ટયુશન માટે શિક્ષક મેક્કલવાની આવે છે. ત્યારે અમે મુંજવણું

અનુભવીએ છીએ. આમ છતાં કેટલાક કિસ્સામાં શિક્ષક ટયુશન અંગે પ્રયત્ન કરતા હોવાની ઇન્દ્રિયાદ વાલી પાસેથી સાંભળીએ ત્યારે આશ્ર્યું અને હુઃખ થાય છે. આવા પ્રયત્ન કરતા શિક્ષક સામેથી પોતાની પ્રતિલા ડલી નથી કરી શકાય એમ જ સમજવું રહ્યું. અમારો વાલીએને જવાભારી પૂર્વકોનો સધિયારો છે કે માત્ર એ કારણે આ સંસ્થામાં બાળકને સહન નહીં કરવું પડે, વાલી એ માટે જે હિંમત દર્શાવી તેમાં અમારો સહકાર હશે.

દિનભાઇના વંદન

સ્વાશ્રય

સ્વાશ્રય એજ સંઝણતાની ચાવી છે. સ્વાશ્રય એટલે પોતે પોતાનું જીવનળુવવા માટે પારકાં પર આધાર ન રાખવો તે. સ્વાશ્રયનું બીજું નામ સ્વતંત્રતા પણ આપી શકાય કારણું કે આપણે દરેક કામ જાતે કરતા હોવાથી આપણે કોઈની ગુલાભી વેઠવી પડતી નથી.

સ્વાશ્રયનું આપણા જીવનમાં ધણું મહત્વ છે. જે આપણે કશી મહેનત કર્યા વગર એસી રહીએ અને પારકા ઉપર આશા રાખીએ તો આપણું તે કામ કરી પૂરું થતું નથી. કોઈએ સાચેજ કણ્ણ છે ને કે “પારકી આશા સહા નિરાશા” ‘જાતમહેનત જિદ્દાબાદ’ આપણે આપણી પોતાની શક્તિ પર આધાર રાખીને સખત મહેનતને આશ્રય લેવો. જેઠાએ અને આપણામાં જાતમહેનત કરવાની ભાવના હોવી જેઠાએ. જે મનુષ્ય પુરુષાર્થ કર્યા વગર નિષ્ક્રિય એસી રહે તે પોતાના સમય જીવનને નિષ્ક્રિયતાએથી ભરી હે છે. તેમજ તે તેના સમય જીવનને વેડિશી નાંખે છે. આમ વિજિત પોતાં જ પોતાનું પતન નોંધે છે.

કોઈપણ વ્યક્તિ પુરુષાર્થ અને પરિશ્રમ કરીને મહાન બની શકે છે. દા.ત. એક સામાન્ય ધરનો છોકરો હતો. તેના પિતાનો ધંધો સુથારનો હતો. એક વખત તે છોકરો એક લાકડાને રંધાથી ખૂબ બસતો હતો. તેથી એક માણસે તેની (અનુસંધાન પાન ૪ ઉપર)

બાલમંહિર

લાંખી રન્નએના અંતે બાલમંહિર ઇરીથી બાળકોના કલરવથી ગુંજતું થયું. શરૂઆતથી જ બાળકોની હજરી સારી એવી રહે છે. આવી રીતે બાળકોને બાલમંહિરમાં નિયમિત મેલુલવામાં આવે, તો અનિયમીતતાને કારણે દૃંધતો વિકાસ અટકે.

લાંખી રન્નએના અંતે બાળકો ભણેલું ભૂલ્યા હશે, બધું નવેસરથી કરાવવું પડ્યો, એવો સંદેહ મનમાં રહ્યા કરતો હતો. પરંતુ ચકાસણીને અતે જણાયું, કે જે વાદી એવી પોતાના બાળક માટે કાળજી લીધી છે. તે બાળકો કશું જ ભૂલ્યા નથી અને જે બાળકો પ્રત્યે વાદીએને ધ્યાન નથી આપ્યું, તેવા બાળકો બધું જ ભૂલી ગયા છે. આવા બાળકો માટે વાદી શૈક્ષિક સંભગતા કેળવે અને બાળકના વિકાસમાં મહુરૂપ બને તો તે બાળકના જ હિતમાં ગણ્યાશે.

બાલમંહિરનો સમય ૧૦-૫૦ થી ૪-૧૫નો છે. બાળકોને સમયસર લાવવા, લઈ જવા, તે પ્રત્યે કાળજી રાણવા વાદીએને વિનંતી.

જ્યોતસ્તનાયેન શાખાન

વાદીએને વિનંતી કે બાળકને લેવા-મૂકવા આવે ત્યારે શાળાના પ્રવેશદાર પાસે પોતાનું વાહન પાર્ક ન કરે શેડા જ સમય માટે પણ સ્ટામાં વાહન પાર્ક ન જ કરવું એવી અમારી આચહનિ વિનંતી છે રીક્ષાવાળાએને પણ અમે સૂચના આપીએ છીએ પરંતુ આપ પણ આ બાધતમાં આપનાથી બનતું બધું કરશો તવી અપેક્ષા.



શિશુ મંહિર

શારહામંહિરમાં અભ્યાસ કરતાં બાળકો સામાન્ય રીતે અભ્યાસમાં તો ઘણું સારું ધોરણું પ્રાપ્ત કરે જ છે. પરંતુ અભ્યાસ ઉપરાંત વિશેષ પ્રકારની હિતર પ્રવૃત્તિમાં પણ શાળાનાં વણું બાળકો વારંવાર વણું આગળ આવે છે. ઘણું ઉત્સાહ બતાવે છે, તે આ શાળાની કાંઈક નેંધ્યપાત્ર સિદ્ધિ છે. બાળકને અભ્યાસ સિવાયની જે કંઈ પ્રવૃત્તિમાં રસ હોય તે અંગે તેની પ્રગટિને વેગ મળો તે માટે સંસ્થા હંમેશા સંભગ રહે છે.

કોઈ બાળચિત્ર હરિકાંધિમાં જાગે છે. કોઈ સંગીત હરિકાંધિમાં પોતાની આગવી પ્રતિબા જાવે છે તો વળી કોઈ રમતગમત કે તરણ, સ્કેરીંગ જેવા ક્ષેત્રે પણ નેંધ્યપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરે છે.

ધોરણું ડક ના ભાઈ સુજલ અતુલભાઈ સુનશી ૧૯૮૪ ના વર્ષની શાંકર્સ ઇન્ટરનેશનલ સ્પર્ધામાં ચંદ્રક પ્રાપ્ત કરી શક્યા છે.

ધોરણું ૫ ક ના ભાઈ અંકુર રાજુભાઈ શાહ ૧૯૮૫ની ગુજરાત લોક કલામંડળ તરફથી સંગીત હરિકાંધિ માં પ્રથમ આવી શાળાનું ગૌરવ વધારવામાં પોતાને ફાળો આપી શક્યા છે.

ધોરણું ૨ ક ના ભાઈ અંકુર રાજુભાઈ શાહ જાપાનનાં વદ્દ ચીલ્ડ્રન આર્ટ એક્ઝીભીશનમાં જોંડ પ્રાઇઝ મેળવી શાળા તેમજ કુદુંબનું ગૌરવ વધારી શક્યા છે.

તા. ૧૦, ૧૧, ૧૨ જુલાઈ, નેશનલ “રોક્સ સ્કૉર્ટિંગ” સ્પર્ધામાં એન ચાંદની પણવા ૧૦ થી ૧૪ વર્ષના એજ ચુપમાં આટિસ્ટીક વિભાગના ઝીજે નખરે આવોને બંસિલવર મેડલ અને એક પ્રોન્જ મેડલ પ્રાપ્ત કરે છે.

આ સૌ બાળકોને સંસ્થા તરફથી અભિનદન પાહવીએ.

આવી જ રીતે શાળાનું પ્રત્યેક બાળક પોતપોતાની શરીકત, કોઈપણ વિષયમાં ઝીલવા પ્રયત્નશીલ બને તેજેવા સૌ વાદીવર્ગને આચહનિ વિનંતી કરીએ છીએ.

| | | |
|---|--------------------|----------------|
| તા. ૧૩-૮-૮૮૫નાં રોજ યોનયેલ ચુંટણીનું પરિણામ | બાધિયો : મહામંત્રી | આલાપ શાહ ડ્રે |
| | ઉપમંત્રી | શોશેવ લગત ડ્રે |
| | અહેનો : મહામંત્રી | સમીપા શાહ ડ્રે |
| | ઉપમંત્રી | અનાર શાહ ડ્રે |
| કુમુનભાઈ શાહ | | |

-: શ્રદ્ધાંજલી :-

આ સંસ્થામાં ધોરણું ૨ બ માં અભ્યાસ કરતાં નિદ્યાર્થી લાઈ મયંક પ્રકાશભાઈ મુનશીનાં આકાશ અવાયાનની નેંધ્ય લેતાં અમે અત્યંત હુઃખ અતુલભીએ છીએ. ઇથેર તેના આત્માને પરમ શાંતિ આપે તેવી પ્રાર્થના.

વિનયમંહિર

॥ સ્વાધ્યાયાત્ ન પ્રમદિતભૂ તબ્યમ् ॥

“સ્વાધ્યાયમાં આગસ ન કરવી.” ઉપનિષદ્ભૂતું આ વાક્ય સર્વને સુચેણ્ય ખોધ આપે છે. શાળાએ નિયમિત શરૂ થઈ ગઈ છે. હવે વિદ્યાર્થીઓએ જરાય સમય ન અગાડતાં વિદ્યાલ્યાસમાં મજન થઈ જવું જોઈએ. બોઈની જાહેર પરીક્ષાઓમાં પ્રથમ વર્ગ સિવાય પાસ થવું તે નિરસ્થક જેવું છે. જે વિદ્યાર્થીએ જે ૭૦%ની આસપાસ શુણુપ્રાપ્ત ઈચ્છિતા હોય તેઓએ નિત્ય ૫ થી ૬ કલાક વાંચન અને લેખન કરવું જોઈએ વર્ગમાં એકાશ્વરતાથી અભ્યાસ કરવો જોઈએ શિક્ષકોની વાણીનું પાન કરવું જોઈએ અને તેઓ જે કંઈ ગૃહકાર્ય આપે ત નિયમિત કરવું જોઈએ

જે વિદ્યાર્થીએ બોઈ કે સેન્ટરમાં આવ્યા છે તેઓની સાથેના વાર્તાલાપ જણવા મજયું છે કે તેઓ ૮૭%ની આસપાસ શુણુપ્રાપ્ત દરરોજના ૧૦ થી ૧૨ કલાકના વાંચન અને લેખન પછી મેળવી શક્યા છે. તેઓએ પેપર્સ પણ સુદ્ધાસર અને સુવાચ્ય અક્ષરોથી લખ્યા હતા. આમ કોઈપણ વિદ્યાર્થી વિદ્યાની આવી સારી અને સાચી ઉપાસનાથી તેજસ્વી પરિણામ લાવી શકે. આપણી શાળામાં એવા વિદ્યાર્થીએ છે કે જેએએ અભ્યાસ અને રમતગમતના ક્ષેત્રે તેમની તેજસ્વિતા દર્શાવી છે. રમતગમત આપણું મનને પ્રકૃતિભરત અને શરીરને સુદૃઢ બનાવે છે. અભ્યાસ અને રમતગમત માટેના સમયનું સુંદર આયોજન અને તેનું પાલન વિદ્યાર્થીએને ઉન્નતિના શિખરે પહોંચાડે છે. આ શાળાનો દરેક વિદ્યાર્થી ઉપનિષદ્ભૂતા ઉપરના વાક્યને ધ્યાનમાં રાખી પ્રગતિ કરશે તેવી અપેક્ષા સાથે વિરમું છું.

દ્રો. ૮-૮ના સંસ્કાર મંડળની મહામંત્રીની ચૂંટણી તા. ૮-૮-૮૫ને શુદ્ધવારના રોજ થઈ જેતું પારણું નીચે પ્રમાણે આપ્યું છું.

ભાઈએ મહામંત્રી

કૌલીન વ્યાસ

ઉપમંત્રી

આનંદ શાખન

ખણો મહામંત્રી

પૂર્વી શાહ

ઉપમંત્રી

મૌસમી વ્યાસ

હેઠાંદ્રભાઈ ઠાકરે

‘એ મારા હાથની વાત છે.’

‘સુજાતા, આજે કેટલે દિવસે મજયાં નહીં?... સ્કુલમાં બધું કેંઠું નહું નહું લાગે છે!....

“અરે તે બાથર્ડમો જોઈ?.... શુસરસ થઈ ગઈ છે!... મને તો આવી બાથર્ડમાં જવું ગમે.... તને ખણર છે? સવારે સાડાદસ વાગે આવીને મેં તે જોઈને હું તો ખુશ ખુશ થઈ ગઈ....’

“ના હોં....તું તો ગખ્પા મારે છે.... ખોપારે હું ગઈ ત્યારે મને તો એવું કંઈએ ન લાગ્યું. બાથર્ડમો એટલી તો ગંધી હતી.... અરે.... કંઈ વાત ન પુછો....” સુચેતાએ વાતને એટકાવતાં કહ્યું.

....અને એ સુજાતા પણ સાચી....ને સુચેતા પણ આવી, વિદ્યાર્થીએને શાળામાં ધણાં કલાકે વિતાવવાનાં હોય છે એટલે બાથર્ડ અને જાજર્ડની સુવિધા એ આરોગ્યની દખિયે અગત્યની સુવિધાએ છે જ, અને એટલે જ સંસ્થા એ સુવિધાએ પૂરી પાડવા હુંમેશા સજાગ રહી છે અને એટલું જ નહીં પણ આ ઉનાળું વેકેશન લંબાઈ જતાં એ સુવિધાએ માટે અમે સારું એવું કામ કરી શક્યા તેનો અમને સંતોષ છે. જતાં જ્યારે સુચેતા જેવા પ્રતિલાઘો સાંબળવા મળે છે ત્યારે એના ઉકેલ માટેનાં અનેક ઉપાયો મનમાં ધૂમરાય છે.

સારી બાથર્ડ થઈ, જાજર્ડ થયાં, રોજ સવારે તેને સંપૂર્ણ રીતે સાઝ કરવામાં આવે છે. તેમાં પાણીની સારી સગવડ પણ કરવામાં આવી અને ઉપરાંત તે સતત સાઝ રહેતે માટે તેની બ્યવસ્થા પણ કરવામાં આવી છતાંય ‘બાથર્ડ ગંધા છે’ એવું કેમ?.... આટલા બધાં વિદ્યાર્થીએ તેનો ઉપયાગ કરે એટલે તે ગંધી થાય તે સમન્ય તેવી વાત છે. સાચે બાથર્ડ વાપરનાર દરેક વિદ્યાર્થી ‘આ મારી બાથર્ડ થે. મારે ઇરી તે વાપરવી પડશે. તને ગંધી કેમ રખાય?....’ એખ્યાલ અને જગૃતિ સાથે તે વાપરે તે બધાંની જ સુરક્ષેલી મટી જય. બાથર્ડમનો ઉપયોગ બાથર્ડ તરીકે જ અને જાજર્ડનો ઉપયોગ જાજર્ડ તરીકે જ કરવો જોઈએ એ શારદામંહિરનાં જગૃત વિદ્યાર્થીએને શીખવવાનું હોય! અને પાણીની સુવિધા હોય પછી બાથર્ડમનો ઉપયોગ કરીને એને ગંધી સુદી બહાર કેમ નીકળાય! ‘બાથર્ડ મારી છે તેની સ્વચ્છતા એ મારા હાથની વાત છે’ એ જગૃતિનાં સંસ્થાનાં દરેક વિદ્યાર્થીનાં મનમાં વસે તો આ ચંગે કોઈને ય સુરક્ષેલી કે ઇચ્છિયાદનો પ્રશ્ન ડિલો. થાય જ નહીં મને લાગે છે વિદ્યાર્થીએમાં આ જગૃત કેળવવા અમને વાતીએનો પણ સહદાર સંપરી જ

ગર્મિલા શાહ

શહીદ વીર વિનોદ કિનારીવાળા।

ભારતની સ્વતંત્રતાની લડતમાં પાથાની ઈટોમાંની એક ઈટ બનનાર શ્રી વિનોદ કિનારીવાલાનો જન્મ હું સ. ૧૯૨૪ની ૨૦મી સપ્ટેમ્બરે અમદાવાદના એક ઘનાદ્ય વૈષ્ણવ કુટુંબમાં થયો. મહાત્મા ગાંધીજી સાથે સારો એવો અંધકારી ધરાવતાં શોધન કુટુંબમાં તેતું મોચાળા અને તેને કારણે સ્વતંત્ર્ય લડત માટેનો જેમ-જુસ્સો શ્રી વિનોદને નાનપણુંથી જ મળેલો.

૮મી ઓગષ્ટની રાત્રે સુંબદ્ધમાં સ્વતંત્ર્ય લડત માટેનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. ૧૯૫૨ની 'હિંદુ છોડો' ની લડત સુંપૂર્ણ સ્વતંત્રતાની પ્રાપ્તિ માટે હુતી અને પૂ. ગાંધીજીએ પ્રણને અહિંસક ખુલ્લો બળવો. કરવા હાકલ કરી. સૌ ડેઝ તેને માટે તૈયાર થયાં. ૮મીની રાત્રે ગાંધીજી સહિત બધાં જ રાષ્ટ્રીય નેતાઓને અંગેજ સરકારે પકડી. લીધાં છે તેવા સમાચાર મળતાં પૂર્વિકરણ મહારાજે રાત્રે અમદાવાદમાં સભા કરી લાખણું આપ્યું, રાષ્ટ્રીય વિદ્યાર્થી સંઘના નેતાઓએ આ લડત જીવી લીધીને હમીએ રાત્રે નક્કી કર્યું કે તા. ૧૦મીએ જવારે લો કોલેજના મેદાનમાં ધ્વજવંહન કરી વિદ્યાર્થીઓનું સરધસ કાઢવું. 'ઈન્ડિલાભ જિદીયાદ'ના સૂત્રો પોકાંતું એ સરધસ ગુજરાત કોલેજ પાસે પહોંચ્યું, પોલીસેઓ તેમને અટકાવ્યા, સરધસમાં સૌથી આગળ વિદ્યાર્થીનીએ હતી. અટકાવ્યા છતાં કેટલાંક વિદ્યાર્થીએ હાથમાં રાષ્ટ્રીયજ સાથે કોલેજના મેદાનમાં પ્રવેશ્યા, તેમાં વિનોદ કિનારીવાળા પણ હતા. પોલીસે સૌ ડેઝને લાડીચાર્ણથી ખૂબ ઘાયલ કર્યા, જેમાં વિદ્યાર્થીએને સમજાવી રહેલાં કેટલાંક અધ્યાપકો પણ હતા. આ બધું કેમ જેયું જય! વિનોદ પોલીસને પડકાર્યા. પોલીસે તનાં હાથમાંથી રાષ્ટ્રીયજ લઈ લેવા કોશિશ કરી, વિનોદ તે હાથમાંથી ના જ મૂક્યો. પોલીસે બંધકની અણી બતાવી છતાં વિનોદ તે કંઈ ડો! ને સામી છાતીએ તણે સામનો કર્યો, તે ગોળીથી વિદ્યાર્થીએ, 'ઈન્ડિલાભ'નો અમરવોાય કરતો વિનોદ ત્યાંજ ફળી પડ્યો, સામી છાતીએ ગોળી ખાઈને નિનોદ શહીદીને વર્ણે એ તેની શહીદીના વેશિષ્ટતા છે.

આજે પણ શહીદ વીર વિનોદ કિનારીવાળાની ખાંલી ગુજરાત કોલેજના મેદાનમાં છે જે ખાંલીનું ઉદ્ઘાટન શ્રી જયપકાજા નારાયણના હસ્તે ૧૦મી ઓગષ્ટ ૧૯૫૭નાં રેજ થયું હતું, એ પ્રસ્તુતે પ્રવચન આપતા તંમણે કહ્યું હતું. "શુદ્ધમાં લોકો નાનતા ગોળીએ ખાઈ મરે છે પણ

વિનોદ સામાન્ય સૌનિકની જેમ સુત્યુ નથી પામ્યો એ વીરતાપૂર્વક, સિદ્ધાંતને ખાતર, દેશના વિરંગી અંડા જાણે તેને હાથમાં રાખી, અડગ રહેતા સુત્યુ પામ્યા છે એજ ટંની મહત્વા છે."

આજાની માટે અનેક વિનોદના લોહી રેડાયા, આવી અમૂલ્ય આજાની સાચવવા અને શોભાવવા હવે આપણુંને અનેક વિનોદના લોહી નહીં પણ પરસેવાની જરૂર છે.

સંક્લન કિન્નર શાહે-૭ ક

'સ્વાશ્રય'

(અનુસંધાન પાન ૨૮ ચાલુ)

મજાક કરી કહ્યું કે "આ લાકડામાંથી જે સિંહાસન બનવાનું છે તેના પર તું બેસવાનો છે તે તેના પાછળ આટવી બધી મહેનત કરે છે?" આ સાંભળી છાકરાને અસંદ્ય અપમાન લાગ્યું પણ તેનાથી તેનામાં એક એવી ધગશ પેઢા થઈ કે હું આ સિંહાસન પર કેમ ન બેસી શકું?" અને તેણે ખૂબ મહેનત કરી લાણીગણી હોશિયાર થઈ ને ન્યાયમૂર્તિ બનીને તે સિંહાસન પર બેઠો અને તેણે જગતને બતાવી આપ્યું કે મનુષ્ય શું નથી કરી શકતો? જો તે ધારે તો તે જાતમહેનત કરીને ઘણું કરી શકે છે.

જો આપણે હાથમાં શરીરા અને હૃદયમાં ડિમત સાથે જિદીલીથી પરિશ્રમ કરીએ તો જગતમાં અનેક સિદ્ધાંતો મેળવી શકીએ અને આપણી પ્રગતિ સાધી શકીએ છીએ આમ. આપણે ડેઝના લરોસે નિષ્ઠક્ય એચી રહેણું જેઠાં નહીં.

કમનસીએ આપણે શિક્ષિત સમાજ સ્વાશ્રયથી દૂર ભાગતો જય છે. શારિરીક અમ પ્રત્યે સૂગ જોવા મળે છે. જ્યારે પશ્ચિમના દેશોમાં શિક્ષિત લોકો પણ પોતાનું કામ જાતે કરવામાં નાનમ સમજતા નથી. મહાત્મા ગાંધીજી, રવિશાંકર મહારાજ, વિનોદા લાંબી સ્વામી વિવેકાનંદ, વળેરેના જીવનમાંથી પ્રેરણા મેળવી આપણે સ્વાશ્રયનો પાડ લઈએ તો તે હચુણીય છે.

આપણી શિક્ષણ પદ્ધતિમાં પણ સ્વાશ્રય પર લાર મૂકવાનો પ્રયાસો થઈ રહ્યા છે. તો આપણે સો નૂતન લારતના ઘડવૈયા સ્વાશ્રયના ઉપાસક બનીએ.

ઇપલ એમ. વ્યાસ ૭ અ